

PNB 1235

ਅਰਜ਼ ਨੰ.	
ਸ਼੍ਰੇਣੀ	ਨਾਨਾ ਯੋਜਨਾ, ਸੀਮਾਂਤ ਯੋਜਨਾ, ਕ੍ਰਿਸ਼ਿ, ਮਯੂਰ, ਅਨਯ

ਸੇਵਾਮਾ,
ਪੰਜਾਬ ਨੈਸ਼ਨਲ ਬੈਂਕ

ਸ਼ਾ. ਕ. _____

ਫੋਟੋਗ੍ਰਾਫ਼

ਕ੍ਰਿਸ਼ਿ ਧਿਰਾਯਾ ਮਾਟੇ ਲੋਨ ਅਰਜ਼ ਫ਼ਾਰਮ

ਏਕਵਾਰ ਅਥਵਾ ਜਯਾਰੇ ਪਯਾ ਫ਼ਿਰਫ਼ਾਰ ਥਾਯ ਟਯਾਰੇ ਮੇਯਵੀ ਸ਼ਕਾਯ ਏ.

A. ਲੋਨ ਸੁਧਿਧਾਨੋ ਪ੍ਰਸ਼ਟਾਯ ਅਨੇ ਪ੍ਰਕਾਰ (ਉਤਪਾਦਨ ਧਿਰਾਯਾ/ਪਾਕ ਲੋਨ/ਕੇਸੀਸੀ/ਕ੍ਰਿਸ਼ਿ-ਮੁਦਤ ਲੋਨ)
- ਲਾਗੂ ਪਡਤੁ ਈਨਟਰਵਯੂ - ਕਮ - ਏਪਰਾਈਯਲ ਫ਼ਾਰਮ ਲੋਨਨਾ ਪ੍ਰਸ਼ਟਾਯਨਾ ਆਧਾਰੇ, ਆ ਅਰਜ਼ ਸਾਥੇ ਯੋਡਵਾਨੁੰ ਰਹੇਸ਼ੇ.

ਲੋਨਨੋ ਹੇਤੁ	ਲੋਨਨੀ ਸੁਧਿਧਾ / ਯੋਜਨਾਨੋ ਪ੍ਰਕਾਰ	ਜੜ੍ਹਰੀ ਰਕਮ (ਰੁ.)

B. ਅਰਜ਼ਦਾਰ(ਰੋ) ਨੀ ਧਿਗਤੋ

ਅਰਜ਼ਦਾਰਨੁੰ ਪੁੜ੍ਹ ਨਾਮ	ਜਨਮ ਤਾਰੀਖ	ਧਰਥ	ਜਾਤੀ	ਆਧਾਰ ਨੰ. (ਧੈਕਲਪੀਕ)	ਮਤਦਾਰ ਓਯਯਪਤਰ/ ਫ਼ਾਈਧੀਗ ਲਾਈਸਨਸ/ ਪਾਨ ਨੰ.
ਸ਼੍ਰੀ/ਸ਼੍ਰੀਮਤੀ _____ ਪੁਤਰ/ਪੁਤ੍ਰੀ/ਪਤਨੀ _____					
ਸ਼੍ਰੀ/ਸ਼੍ਰੀਮਤੀ _____ ਪੁਤਰ/ਪੁਤ੍ਰੀ/ਪਤਨੀ _____					
ਸ਼੍ਰੀ/ਸ਼੍ਰੀਮਤੀ _____ ਪੁਤਰ/ਪੁਤ੍ਰੀ/ਪਤਨੀ _____					

C. પરિવારના સભ્યોની વિગતો

ક્ર.સં.	પરિવારના સભ્યોના નામ	ઉ. વર્ષ	જાતી	સંબંધ	વ્યવસાય	વાર્ષિક આવક (રૂ.)
૧.						
૨.						
૩.						
૪.						
કર્તાનું નામ (સંયુક્ત હિંદુ પરિવારના કિસ્સામાં)						

D. મોબાઇલ નં. સરનામા સાથે

વર્તમાન સરનામું		વર્તમાન સરનામું	
મકાન નં.	શેરી નં.	મકાન નં.	શેરી નં.
ગામ :		ગામ :	
પોસ્ટ ઓફીસ :		પોસ્ટ ઓફીસ :	
તા./મંડલ :		તા./મંડલ :	
જિલ્લો :		જિલ્લો :	
પીનકોડ :		પીનકોડ :	
દૂરભાષ/મોબાઇલ નં. :			

E. સામાજિક શ્રેણી :

સામાજિક શ્રેણી		અનુ. જાતિ	અનુ. જનજાતિ	અન્ય પછાત વર્ગો	શારિરીક રીતે વિકલાંગ		લઘુમતિઓ
જો લઘુમતિઓ		બુદ્ધ	મુસ્લીમ	ઈસાઈ	સિખ	જૈન	પારસી

F. હાલની બેંકિંગ/કેડીટ સુવિધાઓ :

સુવિધાઓના પ્રકાર	હાલમાં _____ સાથે બેંકિંગ કરી રહ્યા છો	ખાતા નંબર	બેલેન્સ (રૂ.)	બાકી રકમ
બચત ખાતુ				
ફિક્સ ડીપોઝીટ				
પ્રધાનમંત્રી જન ધન યોજના ઓ.ડી. ખાતુ				
કાર્યકારી મૂડી લોન/મુદત લોન				
હેઠળ આવરી લેવામાં આવે છે કે કેમ		પી.એમ.જે.જે.બી.વાઈ./ પી.એમ.એસ.બી.વાઈ./ એ.પી.વાઈ.		
જો તમે આ બેંકમાં બેંકિંગ કરી રહ્યા છો, તો ગ્રાહક ID અહીં આપવું જરૂરી છે.				

E. અરજદારની કુલ જમીન ધારણાની વિગતો (જો લીઝ હોલ્ડ/શેર પાક કરનાર હોય, તો સ્પષ્ટ કરો) :

ગામનું નામ	સર્વે/ખસરા નં.	ટાઈટલ			એકરમાં વિસ્તાર	જેમાંથી સિંચાઈ થઈ	જો કોઈ હોય તો સહાય
		માલિકી લીધેલ છે.	ભાડે આપેલ	શેર પાક			

H. ઉપર (G) માં દર્શાવેલ કુલ જમીન મિલકતો, લાગુ કરાયેલ લોનને લગતી જમીન/પાકની વિગતો :

ગામનું નામ	સર્વે/ખસરા નં.	એકરમાં વિસ્તાર	સિંચાઈનો સ્ત્રોત	ઉગાડવામાં આવનાર પાકના નામ		
				ખારીફ પાક	રબી પાક	અન્ય પાક

I. આવકના સ્ત્રોતો :

કૃષીની આવક	
અન્ય આવક (સ્પષ્ટ કરો)	
કુલ આવક	

J. માલિકીની સ્થાવર મિલકતોની વિગતો :

સ્થાવર સંપત્તી	વિગતો/વર્ણન	વર્તમાન બજાર કિંમત (રૂ.)
ખેતી જમીન		
બીનખેતી જમીન		
ઘર/મકાન		
ટ્રેક્ટર શેડ/ફાર્મ શેડ		
માછીમારી તળાવ / તળાવ		
અન્ય		

K. માલિકીની જંગમ મિલકતોની વિગતો :

જંગમ સંપત્તિ	વિગતો/વર્ણન	વર્તમાન બજાર કિંમત (રૂ.)
ખેડાણ કરતા પશુઓ/દુધાળા પશુઓ		
પાળતુ મરઘી		
ટ્રેક્ટર્સ		
પાવર ટીલર		
ઇલેક્ટ્રીક મોટર/પંપ સેટ		
અન્ય સાધનો		

L. ઉધાર લેનાર તરીકે હાલની જવાબદારીઓની વિગતો, જે કોઈ હોય તો :

સંસ્થાનું નામ	લોનનો હેતુ	બાકી રકમ (રૂ.)	કયા ઓવરડ્યુ (રૂ.)	આપવામાં આવેલી સલામતીઓ
આપણી બેંક				
અન્ય બેંક				
કૃષિ ધિરાણ મંડળીઓ				
જમીન વિકાસ બેંક				
અન્ય લેણદારો (સરકારી લેણાં)				
કુલ બાકી રકમ				

M. અરજદારોની સંપત્તી : (J+K+L) રૂ. _____

N. ગેરેંટરની જવાબદારીઓ :

શ્રી/શ્રીમતીને લોન સોંપવામાં આવી	બેંક/સંસ્થાનું નામ	બેંક/સંસ્થાનું નામ	બાકી રકમ (રૂ.)	નિયમિત/મુદતવીતી

O. સુરક્ષા પ્રદાન કરવાની દરખાસ્ત

આપવામાં આવેલી પ્રાથમિક સુરક્ષાની વિગતો	આપવામાં આવેલી કો-લેટરલ સુરક્ષાની વિગતો (જ્યાં લાગુ પડે ત્યાં)

P. આપવામાં આવેલ ગેરેંટર્સ (જો હોય તો)

ગેરેંટર્સનું નામ	વર્ષ	સરનામું	ટેલીફોન/ મોબાઇલ નં.	વ્યવસાય	આવક (રૂ.)

Q. ઘોષણા :

- હું/અમે આથી જાહેર કરીએ છીએ કે મારા/અમારા દ્વારા પુરી પાડવામાં આવેલી બધી માહિતી મારી શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ સાચી અને સંપૂર્ણ છે, અરજી ફોર્મમાં ઉલ્લેખિત સિવાય મારી/અમારી પાસે કોઈ ઉધાર/જવાબદારી નથી.
- હું/અમે આથી બેંકને મારા/અમારા લોન ખાતાઓ સંબંધિત બધી અથવા કોઈપણ વિગતો અથવા માહિતી, કોઈપણ અન્ય નાણાકીય સંસ્થા, સરકાર અથવા કોઈપણ એજન્સી(ઓ) ને જાહેર કરવા માટે અધિકૃત કરીએ છીએ જે બેંક દ્વારા જરૂરી અથવા ઇચ્છનીય માનવામાં આવે.
- જો ઉપરોક્ત મારા/અમારા બાહ્ય ઉધારની ઘોષણામાં હકીકતોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે, તો બેંક મને/અમને બેંક તરફથી કોઈપણ કેડીટ સુવિધાઓ મેળવવાથી ગેરલાયક ઠરાવવા માટે આ જરૂરી રહેશે.
- હું/અમે આ લોન મંજૂર કરતી વખતે બેંક દ્વારા નક્કી કરવામાં આવેલી બાબતો અને શરતોનું પાલન કરીએ છીએ અને લોનની મુદત દરમિયાન અન્ય કોઈ સંપત્તિ હસ્તગત કરવામાં આવે તો બેંકને જાણ કરીએ છીએ.
- બેંક બેંકના લેણાંની વસૂલાત માટે યોગ્ય સલામતી/કાર્યવાહી કરી શકે છે.

1.

1.

2.

2.

3.

3.

અરજદારના હસ્તાક્ષર/અંગુઠાની છાપ

ગેરેન્ટર્સના હસ્તાક્ષર/અંગુઠાની છાપ

તારીખ

સ્થળ

સ્વીકૃતી

_____ ના નિવાસી શ્રી/શ્રીમતી _____ તરફથી _____ ના હેતુથી લોનની અરજી મળેલ છે.

અરજદાર દ્વારા જરૂરી બધી માહિતી/દસ્તાવેજો _____ ના રોજ પુરા પાડવામાં આવેલ છે/પુરા પાડવાના બાકી છે.

તારીખ

અધિકારી/મેનેજર

..... અહીંથી કાપવું

ગ્રાહક નકલ :

_____ ના નિવાસી શ્રી/શ્રીમતી _____ તરફથી _____ ના હેતુથી લોનની અરજી મળેલ છે.

અરજદાર દ્વારા જરૂરી બધી માહિતી/દસ્તાવેજો _____ ના રોજ પુરા પાડવામાં આવેલ છે/પુરા પાડવાના બાકી છે.

તારીખ

અધિકારી/મેનેજર

ખાસ નોંધ :

૧. આ ફક્ત અરજી પ્રાપ્ત થયાની સ્વીકૃતી છે અને આને દરખાસ્તની અમારી સ્વીકૃતીના સંકેત તરીકે ગણવી જોઈએ નહીં, જેનાં પર નિર્ણય દરખાસ્તકર્તા દ્વારા તેની યોગ્યતા અને/અથવા જો કોઈ શરતો હોય તો તેની પરિપૂર્ણતા પર યોગ્ય વિચારણા કર્યા પછી જ લેવામાં આવશે, જે બેંક દ્વારા નક્કી કરવામાં આવી શકે છે.
૨. બેંક દ્વારા જરૂરી બધી વિગતો/ડેટા/દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી જ અરજી પર વિચારણા કરવામાં આવશે.
૩. બેંક દ્વારા માંગવામાં આવેલી બધી વિગતો/કાગળો/દસ્તાવેજો/સ્પષ્ટતાઓ પ્રાપ્ત થયાની તારીખથી _____ દિવસમાં અરજીનો નિકાલ કરવામાં આવશે.
૪. જો દરખાસ્ત સ્વીકારવામાં ન આવે/વિચારવામાં ન આવે તો તેના કારણો અરજદારને જણાવવામાં આવશે.

ચાદી તપાસો

ચેક લીસ્ટ ફક્ત સૂચક છે અને સંપૂર્ણ નથી અને બેંકની જરૂરીયાતોને આધારે કાઢી/ઉમેરી શકાય છે.

૧. ઓળખનો પુરાવો : મતદાર ઓળખપત્ર/ડ્રાઈવિંગ લાઈસન્સ/પાન કાર્ડ/આધાર કાર્ડ/પાસપોર્ટ/સરકારી સત્તાવાળા દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખપત્ર વગેરેની સ્વ પ્રમાણિત નકલ.
૨. રહેઠાણનો પુરાવો : તાજેતરનું ટેલિફોન બિલ/વીજળી બીલ/મિક્સલત કર રસીદ (૨ મહિનાથી જુની નહીં) / મતદાર ઓળખ કાર્ડ/આધાર કાર્ડ/પાસપોર્ટ સરકાર દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર સત્તાધિકારી/ગ્રામપંચાયત/મ્યુનિસિપાલિટી વગેરે.
૩. અરજદારનો તાજેતરનો ફોટો (૨ કોપી) ૬ મહિનાથી જુનો ન હોઈ તેવો.
૪. જમીનના રેકૉર્ડની વિગતો.